



AN-7481

Seat No. _____

M. Com. (Part - II) Examination

March / April - 2016

2.4.3 : Security Analysis & Portfolio Management

Time : 3 Hours]

[Total Marks : 100

સૂચના : દરેક પ્રશ્ન ૨૦ ગુણ ધરાવે છે.

- 1 “રોકાણ અને સટ્ટો સમાન નથી.” રોકાણ અંગેના કોઈ પણ પાંચ વિકલ્પોની મદદથી વિધાનનું ટીકાત્મક મૂલ્યાંકન કરો.

અથવા

- 1 રોકાણના ખ્યાલને સમજાવી રોકાણની પ્રક્રિયા સમજાવો.
- 2 જોખમનો ખ્યાલ સ્પષ્ટ કરો, જામીનગીરીના રોકાણ સાથે સુસંગત જુદા-જુદા પ્રકારનાં જોખમોનાં ઘટકતત્ત્વો સમજાવો.

અથવા

- 2 સેબી (SEBI)ની માર્ગદર્શિકાઓ સાથે બજારના જાહેર ભરણાં (PUBLIC ISSUE) લાવવાની પ્રક્રિયા સમજાવો.

- 3 પોર્ટફોલિયો એટલે શું ? આ કેવી રીતે ઘડવામાં આવે છે ?

અથવા

- 3 પોર્ટફોલિયોમાં માર્કોવિટ્ઝનાં જોખમો અને વળતરના સિદ્ધાંતને સમજાવો.

- 4 (અ) મૂડી-મિલકત કિંમત નિર્ધારણ મોડેલ (CAPM) સમજાવો.

(બ) પ્રાથમિક બજારની કામગીરી અંગે સેબીના નિયમોની ચર્ચા કરો.

અથવા

- 4 ટેકનિકલ એનાલિસિસની વિવિધ ટેકનિક્સ સમજાવો.

- 5 ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)
- (1) બીટાની ગણતરી
 - (2) આર્બિટ્રેજ પ્રાઈઝિંગ થીયરી
 - (3) ભારતમાં રેટિંગ એજન્સીઓની કામગીરી
 - (4) કાર્યક્ષમ બજાર ઉત્કલ્પના.

ENGLISH VERSION

Instructions : Each question carries equal 20 marks.

- 1 "Investment and Speculation are not same". – Explain statement critically with the help of any five investment alternatives.

OR

- 1 Explain the element of investment and discuss the process of investment.
- 2 Conceptualize Risk – Explain the elements of different types of risk associated with security investment.

OR

- 2 Discuss the process of public issue in market with SEBI guideline.
- 3 What is Portfolio? How this portfolio will be constructed ?
- OR**
- 3 Discuss the Markowitz risk and return relationship in portfolio.

- 4 (a) Explain Capital Assets Pricing Model
(b) Narrate SEBI regulations for primary market operations.

OR

- 4 Discuss the various techniques of technical analysis.

- 5 Write Short Notes : (Any **Two**)

- (1) Calculation of beta
- (2) Arbitrage Pricing Theory
- (3) Role of rating agencies in India
- (4) Efficient market hypotheses.